### BHAKTI GEMS AND JEWELLERY LIMITED

CIN.: L36910GJ2010PLC060064

**Regd. Off.:** FF/02, 413/1 Kalp Bhakti House, Nr Narayan Society, B/h Axis Bank, C G Road, Ashram Road P.O, Ahmedabad-380009, Gujarat, India.

Website: www.bhaktijewellery.com

Contact No. 079-26421701

Email ID: compliancebhakti@gmail.com

### Date: April 04, 2024

To, The General Manager-Listing Corporate Relations Department BSE LIMITED PJ Towers, 25th floor, Dalal Street, MUMBAI -400 001

**Subject:** Submission of copies of Newspaper Advertisement pursuant to Regulation 47 of the SEBI (LODR) Regulations, 2015 **Ref.:** Scrip Code - 540545

Dear Sir/ Ma'am,

With respect to the captioned subject, please find enclosed the copy of newspaper advertisement dated April 04, 2024, which was published in Newspapers Business Standard and Jai Hind-Ahmedabad edition informing members of the company regarding conveying Extra Ordinary General Meeting (EGM) of the members of Bhakti Gems and Jewellery Limited will be held on Tuesday, the 30<sup>th</sup> day of April, 2024 at the registered office of the Company situated at FF/02, 413/1 Kalp Bhakti House, Nr Narayan Society, B/h Axis Bank, C G Road, Ahmedabad Ashram Road P.O City Taluka Ahmedabad GJ 380009, India.

You are requested to take the same on records, upload at your website & intimate the same to the members of the Stock Exchange.

Thanking you,

Yours faithfully,

### For Bhakti Gems and Jewellery Limited

SEVANTILA L MEHTA

AKSHAY



Akshay Sevantilal Mehta Managing Director DIN: 02986761

# **Recovery in ad revenues** may help Sun shine again

Brokerages positive on Sun TV, given its attractive valuations

RAM PRASAD SAHU

Mumbai, 3 April

he stock of Sun TV Network is down 17 per cent from its January highs on weaker than expected December quarter performance, delays in the pickup of advertising revenues, and a cut in earnings expectations.

Brokerages are positive on the stock given its attractive valuations and expect a re-rating if there is value unlocking for its IPL franchise.

The company's revenues were up 3 per cent year-on-year (Y-o-Y) but missed brokerage expectations. JM Financial Research says revenues were 7 per cent below its estimates and were driven by lower movie distribution revenues.

While overall core revenues were in line, advertising revenue growth was down 3 per cent Y-o-Y as the Cricket World Cup likely diverted FMCG ad spend towards cricket.

Abhishek Kumar and Anuj Kotewar of JM Financial Research expect a more gradual recovery in advertising revenues as still soft volume growth and weak rural demand will likely cap FMCG ad spend. However, subscription revenue is likely to sustain its momentum.

The brokerage has a buy rating with an unchanged target price of ₹750.

While Sun TV has a strong presence in the South, Nuvama Research highlights that forays by national players such as Zee into the southern market have been successful, while Sun TV's foray into the northern market needs to be more focused.

The other area where Sun TV needs to




ment. According to analysts led by Abneesh Roy of Nuvama Research, "At present, it is recycling linear and movie content into OTT.

It would have to be more aggressive in creating originals and obtaining movie rights for its OTT platform, apart from marketing, to benefit from the fastexpanding digital media segment."

The brokerage has a buy rating on the company with a target price of ₹800 a share.

Elara Capital is bullish on the company given that Sun Network has outperformed on the advertising revenue growth front with an uptick of 19 per cent over the FY21-23 period compared to the overall India TV industry growth of 16.7 per cent.

According to Karan Taurani and Rounak Ray of the brokerage, "We believe the regional genre may not see a rapid decline in consumption and cord-cutting compared to the Hindi genre, due to limited adoption of regional content on digital standpoint.



improve is the over-the-top (OTT) seg- and higher time spent on linear TV within the South vs pan-India averages.

> Its operating profit margins at 64-66 per cent remain well ahead of peers due to a regional content focus, which has a lower content cost, production of exclusive fictional content with a higher return on investment, the absence of involvement in sports properties, and no investment in originals for SUN NXT, say the analysts.

> The brokerage has a buy rating on the stock with a target price of ₹800 and believes that the core broadcasting segment is trading at an inexpensive valuation of 7.0 times the FY26 price-to-earnings ratio despite outperformance in TV advertising and healthy profitability. Elara Capital expects a re-rating towards a 12.0 times one-year forward price-to-earnings ratio for the core TV segment. In addition to the valuations, brokerages point out that healthy per 4 cent dividend yield and 6 per cent free cash

> flow yield are positive from an investment

### SRM Contractors shares close 12% higher in debut trade

development company SRM Contractors closed with gains of 12 per cent over the issue price in its maiden trade on Wednesday.

Shares of the company were listed at ₹225, reflecting a pre- scrip ended at ₹226 per piece, mium of 7.14 per cent to the up by 7.49 per cent. issue price of ₹210 per share on

Engineering, construction and BSE. The stock closed the day the company hit the upper cirat ₹236.20, reflecting a jump of cuit limit on both bourses. 12.48 per cent from the issue At close, the company's price. On the NSE, SRM market valuation stood at Contractors shares listed at ₹541.94 crore on the BSE. ₹215.25, up by 2.50 per cent In volume terms, 10.11 lakh

equity shares were traded on against the issue price. The the NSE while 3.49 lakh shares were traded on the BSE during During the day, shares of the day. On Wednesday, the 30-

share BSE Sensex benchmark fell 27.09 points, or 0.04 per cent, to close at 73,876.82.

The broader Nifty went lower 18.65 points to end at 22,434.65. The Initial Public Offering (IPO) of SRM Contractors got subscribed 86.57 times on the last day of bidding on March 28. PTI

# Keep low-cost Nifty 50 index fund at core of your portfolio

SANJAY KUMAR SINGH & KARTHIK JEROME

S&P Dow Jones Indices recently published the S&P Indices Versus Active Funds (SPIVA) India scorecard for the year ended December 2023. Over a five-year horizon, 85.7 per cent largecap funds failed to beat their benchmarks. The number was lower at 58.1 per cent for the mid/smallcap category.

### **Key takeaways**

Active funds are struggling to beat their benchmarks, especially over longer horizons. "To think that just by investing in active funds you will be able to enjoy alpha is incorrect. Do not ignore passive funds just because they give returns similar to their benchmark," says Siddharth Srivastava, head-ETF (exchange-traded fund) product and fund manager, Mirae Asset Investment Managers (India).

Largecap active funds' performance has improved over the past year. "Only 51.6 per cent largecap funds have underperformed the benchmarkover this period, much lower than

in past SPIVA reports," says Ravi Saraogi, co-founder, Samasthiti Advisors. One reason for this,


according to him, is that largecap funds are allowed to have 20 per cent exposure to mid-and smallcap stocks, which have very well. Over the three, five and 10-year periods, the largecap

category's performance remains poor. In the mid-/smallcap category, 73.6 percent of funds underperformed over one year.

Some experts are of the view that the clubbing of the midcap and the smallcap category and comparing this merged category's performance with the S&P BSE 400 MidSmallCap Index has blurred the picture. "One would have preferred to see segregated data for the midcap and the smallcap category. And their performance should have been compared to indices such as the S&PBSE MidCap and the S&PBSE SmallCap index respectively. That would have been more informative. even if the number of funds in each category was small," says Saraogi,

### MOST ACTIVE FUNDS STRUGGLE TO BEAT **BENCHMARK OVER LONGER HORIZONS**

Percentage of funds outperformed by the index (based on absolute return) ■1-year = 3-year = 5-year ■10-year(%)



Actionable points

The SPIVA report makes a strong case for going passive. "Investors should just stick to a single market cap weighted passive index fund based on the Nifty 50 index," says Avinash Luthria, a Securities and Exchange Board of India (Sebi) registered

investment advisor (RIA) and founder, Fiduciaries. He does not recommend midcap and smallcap funds due to their potential for high volatility. Despite nearly 50 per cent largecap funds beating the benchmark over the pas YOUR year, financial advisors are not convinced about going MONEY active in this segment. "Based on one-year data, the

chance of outperformance still remains only 50:50. Longer-term data, moreover, suggests that passive is the way to go in this segment. For this view to change, active largecap funds would have to show sustained outperformance," says Saraogi.

The performance of midcap and smallcap funds, according to Saraogi, is better when compared separately to a midcap index and a smallcap index respectively. "In these segments, I recommend going with active funds," he says.

### Build core and satellite exposure

Investors should, according to Srivastava, use a mix of active and passive funds. Many advisors use the

concept of core (70 per cent of total) and satellite (30 per cent) portfolios. The core portfolio should have safe assets with low volatility. A Nifty 50based passive fund is an ideal fit here.

In the satellite portfolio, investors may take some risk to generate outperformance. They may include midcap and smallcap funds, factor funds (the more volatile ones), and so on, here.

### Index fund or ETF?

Most advisors favour index funds for retail investors, as they are simpler. "Go with any Nifty 50-based fund having an expense ratio of 20 basis points or less," says Luthria.

According to Srivastava, when choosing an index fund, one should compare the expense ratio and the tracking error/tracking difference (measures of how closely the fund replicates the benchmark's performance). Lower is better for all these criteria.

Saraogi suggests going with an index fund with at least a five-year track record and sticking to one of the top five by AUM.


In an ETF, investors need to (in addition to the criteria mentioned above) check liquidity on the exchanges. "The ETF should have maintained a trading volume of at least 1 crore every day in the recent past and should not pay out dividends," says Luthria.

**BHAKTI GEMS AND JEWELLERY LIMITED** Registered Office : FF/02, 413/1, Kaip Bhakti House, Nr. Narayan Society, B/h. Axis Jank, C.G. Road, Ashram Road P.O., City Taluka Ahmedabad, Gujarat, India, 380009 Website : www.bhaktijewellery.com; || Contact No. : 9428508418 Email ID : compliancebhakti@gmail.com; || CIN : L36910GJ2010PLC060064 NOTICE OF EXTRA ORDINARY GENERAL MEETING

Notice is hereby given that the Extra Ordinary General Meeting (EGM) of the members of Bhakti Gems and Jeweilery Limited ("the Company") will be held on Tuesday, the 30th day of April, 2024 at 11:00 A.M. at the registered office of the Company situated at F/102, 1131/1 Kalp Bhakti House, Nr. Narayan Society, B/h. Axis Bank, C.G. Road, Ashram Road P.O, City Taluka Ahmedabad GJ 380009 to transact the businesses as set out in the Notice of EGM which is being circulated for convening the EGM. The company already dispatched the notice of EGM, through electronic mode to the shareholder whose email addresses are registered with the company and / or Depositories in accordance with the circulare issue by the MCA and SEB. The notice EGM is also available on the website of National Depository services limited (NSDL) at www.evoting.nsdl.com and on the website of the Company www.bhaktijewellery.com Remote e-voting and e-voting during EGM: Remote e-voting and e-voting during EGM:

As per Section 108 of the Companies Act,2013 read with rules made there under and Regulation 44 of SEBI (LODR) Regulations, 2015 and the Secretarial Standards on General Meeting ("SS-2") issued by the ICSI, the Company is providing facility to all its Members to cast their vote on all resolutions to be set forth in the Notice of the EGM by electronic means (e-voting) by using electronic voting system provided by the NSD. The writing dable of the members head the is the respective to the

### Personal Finance, **Insight Out**



Personal Finance, Monday to Saturday

To book your copy, sms reachbs to 57575 or email order@bsmail.in



equity share held by them in the paid-up equity share of the Company as on Tuesday, 23/04/2024 (the "cut-off date"), The details are required pursuant to the provision of the Companies Act, 2013 and rules made thereunder are given below:				
(1) The Book closure period shall commence on Wednesday, 24/04/2024 to Tuesday, 30/04/2024 (Both days inclusive); (2) The remote e-voting period will commence at Saturday, 27/04/2024 at 5.00 p.m.				
<ul> <li>(3) Cut-off date for determining rights of entitlement of e-voting is Tuesday, 23/04/2024;</li> <li>(4) The members will not be allowed to vote through remote e-voting beyond the</li> </ul>				
period as specified above; (5) Shareholder acquiring the share of the company and becomes the members of the company after sending of the Notice and holding Shares as of the cut-off date may follow steps mention in the Notice of EGM to exercise their				
voting rights; (6) The Members who have cast their vote by remote e-voting prior to the EGM may also attend/participate in the EGM but shall not be entitled to cast their vote				
again. Members who have not casted their vote through remote e-voting shall be eligible to vote through e-voting facility during the EGM. (7) A person whose name is				
recorded in the register of members or in the register of beneficial owners maintained by the depositories as on the cut-off date only shall be entitled to avail the facility remote e-voting as well as voting in the general meeting. (8) In case of any queries/				
grievances pertaining to remote e-voting you may refer to the Frequently Asked Questions ('FAQs') for Shareholders and e-voting user manual for Shareholders available				
at www.evoting.nsdl.com under help section or contact at 022-23058542/43. (9) The Board has appointed M/s. Neelam Somani & Associates, Practising Company Secretary				
to act as the Scrutinizer to scrutinize the e-voting procedure.				
For, Bhakti Gems and Jewellery Limited Date : 03/04/2024 sd/- Akshay Sevantilal Mehta				
Place : Ahmedabad Managing Director (DIN: 02986761)				

### बैंक ऑफ बडौदा Bank of Baroda

At & Po Limda, Near Ramji Mandir, Tal.- Waghodia Dist. Baroda-391760 Email:limda@bankofba

Limda Branch

APPENDIX -IV [Rule 8(1)] POSSESSION NOTICE (Immovable Property) Whereas, The undersigned being the Authorized Officer of the Bank of Baroda under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 and in exercise of Powers conferred under Section 13(12) read with (Rule-8) the Security Interest (Enforcement) Rules, 2002, issued a demand notice dated 13-04-2023 calling upon the Borrowers/Guarantor/ Mortgagor Mr. Yogesh L Kapadnis & Mr. Lotan Pandurang Kapadnis to repay the amount mentioned in the notice being Rs. 8,02,119/- (Rupees Eight Lakh Two Thousand One Hundred Nineteen Only) as on 13-04-2023 and unapplied interest and other charges thereon within 60 days from the date of notice/date of receipt of the said notice. The Borrowers/Guarantor/Mortgagor having failed to repay the amount, notice is hereby given to the Borrowers/Guarantor/Mortgagor and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/her under Section 13(4) of the said Act read with Rule 8 of the said Rules on this 31th Day of March of the year 2024.

The Borrowers/Guarantor/Mortgagor in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the **Bank of Baroda** for an amount of Rs. 8,02,119/- (Rupees Eight Lakh Two Thousand One Hundred Nineteen Only) as on 13-04-2023 and interest plus other charges thereon.

The borrower's attention is invited to provision of sub section (8) of the section 13 of the Act, in respect of time available, to redeem the secured assets

### DESCRIPTION OF IMMOVABLE PROPERTY

All that piece and parcel of the Land with construction thereon the immovab residential property being registration Distriuct Vadodara Sub. District Vadodara At village Tarshali, S. No. 414/P City Survey No. 1300, Gujrat Housing Board Scherr House No. 128, adm. 31.20 So. Mtrs. Situated at Village Tarsali Taluka & Distruic Vadodara owned and possessed by Mr. Yogesh L Kapadnis. Bounded: East: Road West: House No. 113, North: House No. 127, South: House No. 129.

Authorised Officer

Bank of Baroda

business-standard.com



businessstandard 🗙 bsindia

Date: 31.03.2024

Place: Vadodara

### THURSDAY • 4-4-2024 **03**

### **JAI HIND - AHMEDABAD**

### ઓપિનિયન પોલ કેજરીવાલની ધરપકડ બાદ હાથ ધરાયો

# દિલ્હીમાં તમામ સાત બેઠકો ભાજપને ફાળે જઈ શકે છે

પહોંચ્યો છે. દિલ્હીમાં હાલ આ લોકસભા ચંટણીમાં વિપક્ષ નવા પ્રયોગ સાથે મેદાનમાં ઉતર્યો છે અને એકબીજાના ધૂર વિરોધી રહેલા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આ વખતે ભેગા થઈને ભાજપનો સામનો કરી રહ્યા છે. કોંગ્રેસ ૩ લોકસભા બેઠકો પર તો આમ આદમી પાર્ટી ચાર લોકસભા બેઠકો પર ચંટણી લડી રહ્યા છે.

નવી દિલ્હી, તા.૩ જેમ જ જબરદસ્ત પ્રદર્શન કરી અલગ અલગ ચૂંટણી લડી રહ્યા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ શકે છે. દિલ્હીમાં તમામ ૭ હતા અને ભાજપને દરેક સીટ કેજરીવાલ હાલ તિહાડ જેલમાં બેઠકો ભાજપને ફાળે જઈ શકે પર પર ટકાથી વધુ મત મળ્યા બંધ છે. આ બધા વચ્ચે દેશમાં છે. જ્યારે આમ આદમી પાર્ટી હતા. જો ૨૦૧૯ના આંકડા પર લોકસભા ચૂંટણીના કારણે દરેક અને કોંગ્રેસ ગઠબંધનને દિલ્હીમાં નજર ફેરવીએ તો આમ આદમી પક્ષોનો પ્રચાર પણ ચરમસીમાએ શૂન્ય બેઠક મળી શકે છે.

આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ ગઠબંધનને દિલ્હીમાં શૂન્ય બેઠક મળી શકે છે : ઓપિનિયન પોલના તારણ

લોકસભા ચૂંટણી ઢૂંકડી છે અને ૨૦૧૯ની લોકસભા ત્યારે મતદાન પહેલા ઈન્ડિયા ચૂંટણીમાં પણ આવી જ જોવા દળને એક બેઠક મળી શકે છે. ટીવી અને CNX એ કરાવેલા મળી હતી. જો આ ઓપિનિયન ઈન્ડિયા ગઠબંધન હેઠળ આપ ઓપિનિયન પોલના તારણો પોલના તારણો સાચા ઠર્યા તો અને કોંગ્રેસ બંને તેમાં સામેલ છે સામે આવ્યા છે. આ સ્પષ્ટ છે કે દિલ્હીની સીટો પર પરંતુ પંજાબમાં સ્થિતિ અલગ છે ઓપિનિયન પોલ અરવિંદ ગઠબંધનની કોઈ અસર નહીં કારણ કે પંજાબમાં આમઆદમી કેજરીવાલની ધરપકડ બાદ હાથ થાય કે અરવિંદ કેજરીવાલની પાર્ટી અને કોંગ્રેસ એકબીજાની ધરાયો હતો. પોલ મુજબ ધરપકડનો પાર્ટીને પણ કોઈ જોડે નહીં પણ સામે છે. જેનું દિલ્હીની તમામ ૭ બેઠકો પર ફાયદો નહીં થાય. ૨૦૧૯ની નુકસાન પણ થતું દેખાઈ રહ્યું ભાજપ ૨૦૧૪ અને ૨૦૧૯ની લોકસભા ચૂંટશીમાં બંને પક્ષો હોય તેવું લાગે છે.

પાર્ટી અને કોંગ્રેસ મળીને પણ <sup>ં</sup>બંને પક્ષોની સ્થિતિ ૨૦૧૪ ભાજપને માત આપી શકે તેમ નહતા

ઓપિનિયન પોલ મુજબ પંજાબમાં આમ આદમી પાર્ટીને મોટો ઝટકો મળી શકે છે. ૨ વર્ષ પહેલા બહુમત સાથે સત્તામાં આવેલી આપને લોકસભા ચૂંટણીમાં માત્ર ૬ બેઠકો મળી શકે છે. જ્યારે કોંગ્રેસ અને ભાજપને ૩-૩ બેઠકો પર જીત મળી શકે છે.

જ્યારે શિરોમણી અકાલી



ભૂતપૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધી હત્યા કેસના ત્રણ દોષિત શ્રીલંકન નાગરિકોને જેલમાંથી મુક્ત કરાયો બોદ તેમની પાસે શ્રીલંકન પાસપોર્ટ નહીં હોવાથી વિદેશ નોંધણી કાર્યાલય તરફથી આદેશ મળતા આ દોષિતો ચેન્નાઈ એરપોર્ટથી શ્રીલંકા જવા રવાના થઈ રહ્યા છે.

## ભારતીય વાયુસેનાએ પોતાનો દમ દેખાડ્યો પાકિસ્તાની સીમા નજીક ગરજ્યા રાફેલ-જગુઆર

### નવી દિલ્હી, તા.૩ કરશે

ભારતીય વાયુસેનાં આ દિવસોમાં નવા મિશનમાં વ્યસ્ત છે. વાત જાણે એમ છે કે, વાયુસેનાએ

તમામ એરફોર્સ સ્ટેશન એક પછી એક ભાગ લઈ રહ્યા છે અને પોતાની તાકાતનું પ્રદર્શન કરી રહ્યા છે. આ અભિયાન ૧ એપ્રિલ ૨૦૨૪થી શરૂ કરવામાં આવ્યું છે. પ્રથમ દિવસે પોખરણ સ્થિત ફિલ્ડ આયોજન કરવામાં આવ્યું હતું. ગગન શક્તિ-૨૦૨૪ નામની ઓ

કરવામાં આવી રહી છે.

આ કવાયતમાં સામેલ ફાઈટર

પ્લેન અને હેલિકોપ્ટર છે તેજસ,

રાફેલ, સુખોઈ-૩૦, જગુઆર,

મિરાજ ૨૦૦૦, ચિનૂક, અપાચે

અને પ્રચંડ વગેરે. આ સિવાય

એરફોર્સના ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ

ગ્લોબમાસ્ટર, ઝ-૧૩૦ત સુપર


હર્કૂયુલસ, ઝ-૨૯૫ના પરાક્રમ પશ

અહીં જોવા મળશે. વાયુસેના

ગગનશક્તિમાં તેની એરિયલ

શક્તિ-૨૦૨૪ નામ આપ્યું છે. આ આ સમયગાળા દરમિયાન જમ્મુ લેન્ડિંગ અને ટેકઓફ કામગીરીનું ૧૦ દિવસીય કવાયતમાં દેશના અને કાશ્મીર, ચંદીગઢ, અંબાલા, આયોજન કરવામાં આવ્યું છે. બીજું

ફાયરિંગ રેન્જમાં દાવપેચનું રાજસ્થાન અને યુપીની વ્યૂહાત્મક રનવે પેચ છે જ્યાં રસ્તાની બંને એરસ્ટ્રીપ્સનો ઉપયોગ અલગ-અલગ દિવસો અને સમયે કરવાનો કવાયતમાં લગભગ ૧૧ હજાર છે. હાલમાં ગગનશક્તિ કવાયતમાં એરમેન ભાગ લઈ રહ્યા છે. સંરક્ષણ ભારતીય વાયુસેના યુપી અને જમ્મુ મંત્રાલયની માર્ગદર્શિકા અનુસાર અને કાશ્મીરેમાં ઘું જીગ્યાએ પશ્ચિમ અને ઉત્તર બંને મોરચાને લેન્ડિંગ અને ટેક-ઓફ દાવપેચ જેમાં ચીન અને પાકિસ્તાન સાથે બે કરી રહી છે. મોરચે યુદ્ધની તૈયારીની કસોટી



Branch	Position	
	HOD	Lecturer
Mechanical Engg.	01	06
Civil Engg.	01	06
Electrical Engg.	01	06

### ભારતીય શેરબજારનું વેલ્યુએશન ઉંચ, છતાં વિદેશીઓને વિશ્વાસ

સેબીની વડા માધવી પુરી બુચે મંગળવારે જણાવ્યું હતું કે મૂડી

બજારનું સમગ્ર માળખું ટ્રસ્ટ પર આધારિત છે. આ ટ્રસ્ટ પારદર્શક સિસ્ટમ દ્વારા પેદા થાય છે. આ જ કારણ છે કે ઊંચા મૂલ્યાંકન છતાં વિદેશી રોકાણકારોને ભારત પર આશા અને વિશ્વાસ છે. ભાવ-કમાણી (PE) ગુણોત્તર ૨૨.૨ છે, જે વિશ્વના ઘણા સૂચકાંકોની સરેરાશ કરતા વધારે છે.

સેબીના વડા માધવી પૂરી ખુચનું સૂચક વિધાન

FINANCE (नोन

PUBLIC NOTICE

ઈન્ડસ્ટ્રી બોડી કોન્ફેડરેશન ઓફ ઈન્ડિયન ઈન્ડસ્ટ્રી (CII)ના ઈવેન્ટમાં બુચે કહ્યું, 'ચોક્કસપણે કેટલાક લોકો કહે છે કે અમારું બજાર મોંઘું છે. હંજુ પણ રોકાણ કેમ આવી રહ્યું છે? કારણ કે ભારત પર આજે વિશ્વનો વિશ્વાસ છે તેના કારણે જ નિયમિતપણે વિદેશી રોકાણકારોને મળે છે. દેશની અર્થવ્યવસ્થામાં વૃદ્ધિને કારણે ભારતમાં તેમનો રસ વધ્યો છે.



The branch of IIFL Finance Ltd., located at First Floor Mahisagar House, Near The branch of IIFL Finance Ltd., located at First Floor, Jay Goga Shopping Center, Nr. Dena Bank Bhabhar, Kotak Mahindra Bank, Highway Char Rasta Kadi District Mehsana, Gujarat -382715, will be shifted to below Banaskantha, Gujarat - 385320, will be shifted to below mentioned address with effect from 01" July, 2024. mentioned address with effect from 01" July, 2024. New Address: IIFL Finance Ltd., Ground Floor, Shop No. 1, 2, 6, Diamond Plaza, Kadi - Thol Road, Taluka Kadi, District-Mehsana, Gujarat - 382715 New Address: IIFL Finance Ltd.,

Ground Floor, Vav Road, Near Happy Mall, Bhabhar, Banaskantha, Gujarat-385320 Contact: 78018 24258 / 99251 42001

જાહેર નોટિસ

આઇ. આઇ. એફ. એવ. ફાઇનાન્સ વિમિટેડ

ની ભાભર ખાતે આવેલી શાખાનું સ્થળાંતર કરી રહ્યા છીએ જેનું જૂનું સરનામું, પ્રથમ માળ, જય ગોગા શોપિંગ સેન્ટર, નં. દેના બેંક ભાભર્

બનાસકાંઠા, ગુજરાત - 385320.નું અંદાજે તારીખ 01.07.2024 થી સ્થળાંતર થશે

385320

ઉપલબ્ધ થશે.

મારતાય વાયુસેનાના આ

ઓપરેશન ૭મી એપ્રિલે

લખનૌ નજીક થશે. માર્ગ

પરિવહન મંત્રાલયે

ભારતીય વાયુસેનાના

સહયોગથી વિશેષ રનવે

પણ તૈયાર કર્યા છે.

ડિવાઈડર વગરના રોડ

પેચ પણ છે. આ ખાસ

બાજુનો ઉપયોગ એરક્રાફ્ટ

ચલાવવા માટે થઈ શકે છે. આ

વ્યવસ્થા ઈમરજન્સી લેન્ડિંગ અને

ેટેક-ઓફ ઓપરેશન માટે કરવામાં

આવી છે. આ કટોકટીની

પરિસ્થિતિઓનો સામનો કરવાનું

Contact: 78748 42078 / 97129 34082 All existing services can be availed a All existing services can be availed at the new location the new location

આઇ. આઇ. એક. એવ. કાઇનાન્સ વિમિટેડ ની કડી ખાતે આવેવી શાખાનું સ્થળાંતર કરી રહ્યા છીએ જેનું જૂનું સરનામું, પ્રથમ માળે મહિસાગર હાઉસ, કોટક મહિન્દ્રા બેંક પાસે, હાઇવે ચાર રસ્તા કડી જિલ્લો મહેસાચા, ગુજરાત - 382715 નું અંદાજે તારીખ 01.07.2024થી સ્થળાંતર થશે

જાહેર નોટિસ

નવું સરનામું: આઇઆઇએકએલ ફાઇનાન્સ લિમિટેડ, ગ્રાઉન્ડ ફ્લોર, દુકાન નંબર 1,2,6, ડાયમંડ પ્લાઝા, કડી - થોલ રોડ, તાલુકા કડી, જિલ્લો -મહેસાણા, ગુજરાત -382715 નવું સરનામું: આઇઆઇએફએલ ફાઇનાન્સ લિમિટેડ, ગ્રાઉન્ડ ફ્લોર, વાવ રોડ, હેપ્પી મોલ પાસે, ભાભર, બનાસકાંઠા, ગુજરાત-

સંપર્ક: 78018 24258 / 99251 42001 સંપર્ક: 78748 42078 / 97129 34082 હાલની તમામ વર્તમાન સેવાઓ નવા સ્થળે હાલની તમામ વર્તમાન સેવાઓ નવા સ્થળે ઉપલબ્ધ થશે.





મુંબઈમાં એનએસઈના સોશિયલ સ્ટોક એક્સચેંજ (એસએસઈ) ખાતે નજીઓ રાઉટસ ૨ સુટર્સના રજિસ્ટર્ડની રિંગિંગ સેરમનીમાં બોલીવુડ એકટ્રેસ જૂહી ચાવલા ઉપસ્થિત નજરે પડે છે.

સિનિયર સિટિઝનનું કન્સેશન પાછું ખેંચી લીધું રેલવેને છેલ્લા ચાર વર્ષમાં રૂ.પ,૮૦૦ કરોડની કમાણી ગગન શક્તિ-૨૦૨૪ હેઠળ ઓપરેશનનો હેતુ ઈમરજન્સીના

વાયુસેના વિવિધ ભાગોમાં સંયુક્ત સમયમાં હાઈવે પર દેશના રીતે ઉત્તર અને પશ્ચિમી મોરચાને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને બતાવવાનો છે. તેના હવાઈ સૈન્ય અભ્યાસને ગગન સામેલ કરીને કવાયત કરી રહી છે. ગગન શક્તિ કવાયત માટે હાઇવે

નવી દિલ્હી, તા.૩ ભાડામાં વરિષ્ઠ નાગરિકોનું કન્સેશન પાછું ખેંચી લીધા પછી અત્યાર સુધીમાં ભારતીય રેલવેને આ પગલાથી રૂ.પ,૮૦૦ કરોડની વધારાની આવક થઈ છે. રાઇટ દુ ઇન્ફર્મેશન એક્ટ (આરટીઆઇ) હેઠળની અરજીમાં રેલવેએ આ ખુલાસો કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, રેલવે મંત્રાલયે ૨૦ માર્ચ, ૨૦૨૦ના રોજ દેશભરમાં કોવિડ-૧૯ને કારણે જાહેર થયેલા લોકડાઉનને પગલે સિનિયર સિટિઝનને રેલવે ભાડામાં મળતું કન્સેશન પાછું ખેંચી લીધું હતું.

કોવિડ-૧૯ને કારણે જાહેર થયેલા લોકડાઉનને પગલે સિનિયર સિટિઝનને રેલવે ભાડામાં મળતું કન્સેશન પાછું ખેંચી લીધું હતું

એ પહેલાં સિનિયર સિટિઝન મહિલાને ૫૦ ટકા અને પુરુષને ૪૦ ટકા કન્સેશન મળતું હતું. કન્સેશન પાછું ખેંચાયા પછી વરિષ્ઠ નાગરિકઓ અન્ય પેસેન્જર્સની જેમ પૂરું ભાડું ચૂકવી રહ્યા છે. મધ્યપ્રદેશના ચંદ્રશેખર ગૌરે આરટીઆઇ હેઠળ ઘણી અરજી કરી હતી. જેના જવાબ અનુસાર ૨૦ માર્ચ ૨૦૨૦થી ૩૧ જાન્યુઆરી, ૨૦૨૪ સુધીમાં રેલવેને સિનિયર સિટિઝનનું કન્સેશન પાછું ખેંચવાથી રૂ.૫,૮૭૫ કરોડથી વધારાની આવક થઈ છે. ગૌરે જણાવ્યું હતું કે, ''મેં આરટીઆઇ એક્ટ હેઠળ ત્રણ

અરજી કરી હતી. પહેલી ૧ એપ્રિલ, ૨૦૨૩થી ૩૧ કેન્દ્ર સરકારે ચાર વર્ષે રેલવે અરજીમાં રેલવેએ ૨૦ માર્ચ, જાન્યુઆરી ૨૦૨૪ સુધીનો ડેટા ૨૦૨૦થી ૩૧ માર્ચ, ૨૦૨૨ અપાયો હતો. સુધીની વધારાની આવકનો ડેટા મળી હતી. મેં ત્રીજી અરજી મને જાણી શકાય."

તેના પરથી ૨૦ માર્ચ, આપ્યો હતો. બીજી અરજીમાં ૨૦૨૦થી ૩૧ જાન્યુઆરી, મને ૧ એપ્રિલ, ૨૦૨૨થી ૩૧ ૨૦૨૪ સુધીની વધારાની માર્ચ, ૨૦૨૩ સુધીની વિગત આવકનું કલેક્શન સહેલાઇથી

### દર્શન ઓર્ના લિમિટેડ

રજિસ્ટર્ડ ઓફિસ : સર્વે નંબર 02105+2106/3/ લવાર ની પોળ, શેખ સરિયા ચેમ્બર્સ, મદન ગોપાલ હવેલી શેડ માણેક શોક અમદાવાદ - ૩૮૦૦૦૧

|| Website:www.darshanorna.co.in || Contact: +91 07922142568 E-mail : compliancingdarshan@gmail.com || CIN : L36910GJ2011PLC063745

### એકસ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગની નોટિસ

આથી નોટિસ આપવામાં આવે છે કે દર્શન ઓર્ના લિમિટેડ("કંપની") ના સભ્યોર્ન એકસ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગ (EGM) સોમવાર, ૨૯મી એપ્રિલ, ૨૦૨૪ ના રો૧ બપોરે ૃં ૦૨ઃ૩૦ વાગ્યે નિર્ધાર્તિ સર્વે નંબર 02105+2106/3/ લવાર ની પોળ, શેખ સરિયા ચેમ્બર્સ, મદન ગોપાલ હવેલી રોડ, માણેક ચોક, અમદાવાદ-૩૮૦૦૦૧ ખાતે યોજાશે કંપનીની રજિસ્ટર્ડ ઑફિસમાં EGM ની નોટિસમાં નિર્ધારિત વ્યવસાયનો વ્યવહાર કરવા માટે EGM બોલાવવા માટે પરિપત્ર કરવામાં આવી રહ્યો છે. કંપનીએ પહેલેથી જ EGM ની નોટિસ ઇલેક્ટ્રોનિક મોડ દ્વારા એવા શેરધારકોને મોકલી દીધી છે કે જેમના ઈમેલ એડ્રેસ કંપની અને/ઐથવા ડિપોઝિટરીઝમાં એમસીએ અને સેબી દારા બહાર પાડવામાં આવેલા પરિપત્રો અનુસાર નોંધાયેલા છે. EGM નોટિસ નેશનલ ડિપોઝિટરી સર્વિસિસ લિમિટેડ (NSDL)ની વેબેસાઇટ www.evoting.nsdl.com અને કંપનીની વેબસાઇટ www.darshanorna.co.ir પર પણ ઉપલબ્ધ છે.

#### EGM દરમિયાન રિમોટ ઇ-વોટિંગ અને ઇ-વોટિંગઃ

સ્થળ : અમદાવાદ

કંપની અધિનિયમ, ૨૦૧૩ ની કલમ ૧૦૮ મુજબ ત્યાં બનાવેલા નિયમો અને SEBI(LODR રેગ્યુલેશન્સ, ૨૦૧૫ ના નિયમન ૪૪ અને ICSI કારા જારી કરાયેલ જનરલ મીટિંગ ("SS 2") પરના સંકેટરીયલ રટાન્ડર્ડ્સ મુજબ કંપની સુવિધાપૂરી પાંડે છે એનએસડીએલ દારો પૂર્ પ્રાડ્વામાં આવેલ ઈલેકટ્રોનિક વાટિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને ઈલેકટ્રોનિક માધ્યમો (ઈ વોટિંગ) દ્વારા ઈજીએમની નોટિસમાં નિર્ધારિત તમામ ઠરાવો પર તમામ સભ્યોને તેમનો વોટ આપવાની સુવિધા આપશે. સભ્યોના મતદાન અધિકારો સોમવાર, ૨૨/૦૪/૨૦૨૪ ("કટ-ઓફ તારીખ") ના રોજ કંપનીના પેઇડ-અપ ઇક્વિટી શેરમાં તેમના દારા રાખવામાં આવેલા ઇક્વિટી શેરના પ્રમાણમાં હોવા જોઈએ. કંપની અધિનિયમ, ૨૦૧૩ ની જોગવાઈ અનુસાર જરૂરી વિગતો છે અને તેના હેઠળ બનાવેલા નિયમો નીચે આપેલ છેઃ

(૧) બુક બંધ કરવાનો સમયગાળો મંગળવાર, ૨૩/૦૪/૨૦૨૪ થી સોમવાર, ૨૯/૦૪/૨૦૨૪ સુધી રહેશે (બંને દિવસો સહિત); (૨) રીમોટ ઈ-વોટિંગ સમયગાળો શુક્રવાર, ૨૬/૦૪/૨૦૨૪ સવારે ૯.૦૦ વાગ્યે શરૂ થશે અને ર્વિવાર, ૨૮/૦૪/૨૦૨૪ ના રોજ સાંજે ૫.૦૦ વાગ્યે સમાપ્ત થશે. (૩) ઈ-વોટિંગના અધિકારો નક્કી કરવા માટેની કટ-ઓફ તારીખ સોમવાર ૨૨/૦૪/૨૦૨૪ છે; (૪) સભ્યોને ઉપરોક્ત જણાવેલ સમયગાળા પછી રીમોટ ઈ-વોટિંગ દારા વોટિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં; (૫) શેરહોલ્ડર કંપનીનો હિસ્સ હસ્તગત કરે છે અને નોટિંસ મોકલ્યા પછી અને કટ-ઓફ તારીખે શેરો હોલ્ડ કર્યા પછી કંપુનીના સભ્ય બને છે તેઓ તેમના વોટિંગ અધિકારોનો ઉપયોગ કરવા માટે ઈજીએમ ની નોટિસમાં જણાવેલ પગલાંને અનુસરી શકે છે: (૬) જે સભ્યોએ ઈજીએમ પહેલાં રિમોર્ટ ઈ-વોટિંગ દ્વારા તેમનો વોટ આપ્યો છે તેઓ પણ ઈજીએમ માં હાજરી/ભાગ લઈ શકશે પરંતુ તેઓ કરીથી તેમનો વોટ આપવા માટે હકદાર રહેશે નહીં. જે સભ્યોએ રિમોટ ઈ વોર્ટિંગ દ્વારા પોતાનો વોટ આપ્યો નથી તેઓ ઈજીએમ દરમિયાન ઈ-વોર્ટિંગ સુવિધા દ્વારા વોટ આપવા માટે પાત્ર રહેશે. (૭) જે વ્યક્તિનું નામ સભ્યોના રજિસ્ટરમાં અથવા ડિપોઝિટરીઝ દારા જાળવવામાં આવેલા લાભાર્થી માલિકોના રજિસ્ટરમાં માત્ર કટ-ઓક તારીખે નોંધાયેલું હોય તે રિમોટ ઈ-વોટિંગની સુવિધા તેમજ જનરલ મીટિંગમાં વોટિંગ કરવ માટે હકદાર છે. (૮) બોર્ડે મેસર્સ નીલમ સોમાણી એન્ડ એસોસિએટ્સ, પ્રેક્ટિસિંગ કંપની સેક્રેટરીની નિમણુક કરી છે જે ઈ-વોટિંગ પ્રક્રિયાની ચકાસણી કરવા માટે સ્કૂટિનાઈઝર તરીકે કામ કરશે, જેઓ વોટિંગના પરિણામો ચેરમેનને સબમિટ કરશે. (૯) રિમોટ ઈ-વોટિંગને લગતી કોઈપણ પ્રશ્નો/ફરિયાદોના કિસ્સામાં તમે શેરધારકો માટે વારંવાર પૂછાતા પ્રશ્નો('FAQs' અને મદદ હેઠળ www.evoting.nsdl.com પર ઉપલબ્ધ શેરધારકો માટે ઈ-વોટિંગ વપરાશકત માર્ગદર્શિકા વિભાગ જોઈ શકો છો અથવા ૦૨૨-૨૩૦૫૮૫૪૨/૪૩૫૨ સંપર્ક કરો.

દર્શન ઓર્ના લિમિટેડ માટે તારીખ: ૦૩-૦૪-૨૦૨૪ sd/- อิติย หลังจุดเป ยิธ મેનેજિંગ ડિરેકટર (DIN : 07100840)



### PUBLIC NOTICE

The branch of IIFL Finance Ltd., located at Shop No. 1 & 2, KV Complex, Above State Bank Of India, Station Road, Main Bazar, Chhapi Banaskantha, Gujarat -385210, will be shifted to below mentioned address with effect from 01" July, 2024.

New Address: IIFL Finance Ltd., Ground Floor, Shop No.7,8,9,10, Bhoomi Plaza, Near Bank Of Baroda, Opposite Ambaji Mandir, District -Chhapi, Gujarat-385210 Contact: 95743 03174/97129 34082 All existing services can be availed at the new location.

#### જાહેર નોટિસ

આઇ.આઇ.એફ.એવ. ફાઇનાન્સ વિમિટેડ ન છાપી ખાતે આવેવી શાખાનું સ્થળાંતર કર કાર્યા બોલી બોલ થાયેલ શાળાવું સ્વર્ગાણ કરત રહ્યા છીએ જેનું જૂનું સરનામું હુકાન ને અને 2, કે.વી. કોમ્પ્લેક્સ, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાની ઉપર, સ્ટેશન રો.ડ, મુખ્ય બજાર, છપી બનાસકાંઠા, ગુજરાત - 385210 નું અંદાજે તારીખ 01.07.2024 થી સ્થળાંતર થશે નવું સરનાયું આછઆછ્યે ક્યેલ ફાઇનાન્સ લિમિટેડ, ગ્રાઉન્ડ ફ્લોર, ગ્રાઉન્ડ ફ્લોર, દુકાન નં. 7,8,9,10, ભૂમિ પ્લાઝા, બેંક ઓફ બરોડા પાસે, અંબાજી મંદિરની સામે, જિલ્લો- છાપી, ગુજરાત - 385210 સંપર્ક: 95743 03174/97129 34082 હાલની તમામ વર્તમાન સેવાઓ નવા સ્થળે ઉપલબ્ધ થશે.



### PUBLIC NOTICE

The branch of IIFL Finance Ltd., located at Ground Floor, Near ICICI Bank, Opposite Balmukund Square, Ahmedabad Road, Dehgam, Gandhinagar, Gujarat - 382305, will be shifted to below mentioned address with effect from 01" July, 2024. New Address: IIFL Finance Ltd., Ground Floor, Pushpraj Arcade, Beside Bank Of Baroda, Near Jain Temple, Dehgam, Gujarat-382305 Contact: 99784 40011 / 90990 28865 All existing services can be availed at the new location.

#### જાહેર નોટિસ

આઇ.આઇ.એફ.એલ.ફાઇનાન્સ લિમિટેડની દહેગામ ખાતે આવેલી શાખાનું સ્થળાંતર કરી રહ્યા છીએ જેનું જૂનું સરનામું, ગ્રાઉન્ડ ફ્લોર, આઈસીઆઈસીઆઈ બેંક પાસે, બાલમુકુંદ સ્ક્વેર સામે, અમદાવાદ રોડ, દહેગામ, ગાંધીનગર, ગુજરાત - 382305. નું અંદાજે તારીખ01.07.2024થી સ્થળાંતરથશે નવું સરનામું: આઇઆઇએફએલ ફાઇનાન્સ લિમિટેડ, ગ્રાઉન્ડ ફ્લોર, પુષ્પરાજ ઑર્કડ, બેંક ઓફ બરોડાની બાજુમાં, જૈન મંદિર

પાસે, દહેગામ, ગુજરાત-382305 સંપર્ક: 99784 40011 / 90990 28865 હાલની તમામ વર્તમાન સેવાઓ નવા સ્થળે ઉપલબ્ધ થશે.

 $\oplus$ 

Automobile Engg.	01	04
Computer Engg.	01	04
Automobile Engg. Computer Engg. Mathematics English/Physics/Chemistry	200	01
English/Physics/Chemistry	-	01 (each)
Librarian	-	01
Admin Staff/ Lab Assit	-	05

Eligibility criteria and salary as per AICTE and GTU and Gujarat Govt. norms Posts may vary at the time of Interview.

Candidate May send their Resume by Regd.Post,Email or at Institute office with two Photographs and certified Copies of all relevant documents within 15 days. Incomplete application will be rejected without any intimation

### ભક્તિ જેમ્સ એન્ડ જવેલરી લિમિટેડ

રજિસ્ટર્ડ ઓફિસ : FF/૦૨, ૪૧૩/૧, કલ્પ ભક્તિ હાઉસ, નારાયણ સોસાયટી પાસે, એક્સિસ બેંક પાછળ, સી.જી. રોડ, આશ્રમ રોડ પો.ઓ., શહેર તાલુકા અમદાવાદ, ગુજરાત, ભારત, 32000C || Website : www.bhaktijewellery.com; || Contact No. : 9428508418 Email ID : compliancebhakti@gmail.com; || CIN : L36910GJ2010PLC060064

#### એકસ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગની નોટિસ

આથી નોટિસ આપવામાં આવે છે કે ભક્તિ જેમ્સ એન્ડ જ્વેલરી લિમિટેડ ("કંપની" ના સભ્યોની એકસ્ટ્રા ઓર્ડિનરી જનરલ મીટિંગ (EGM) મંગળવાર, ૩૦મી એપ્રિલ ૨૦૨૪ ના રોજ સવારે ૧૧:૦૦ વાગ્યે FF/0૨, ૪૧૩/૧, કલ્પ ભક્તિ હાઉસ, નારાયહ સોસાયટી પાસે. એક્સિસ બેંક પાછળ, સી.જી. રોડ, આશ્રમ રોડ પો.ઓ., સીટી તાલુક અમદાવાદ GJ ૩૮૦૦૦૯ ખાતે યોજાશે. EGM ની નોટિસ જે EGM બોલાવવા મા પ્રસારિત કરવામાં આવી રહી છે. કંપનીએ પહેલેથી જ \_EGM ની નોટિસ ઇલેક્ટ્રોનિક મોડ દ્વારા એવા શેરધારકોને મોકલી દીધી છે કે જેમના ઈમેલ એડેસ કંપની અને/અથવ ડિપોઝિટરીઝમાં રજિસ્ટર્ડ છે. એમસીએના અને સેબીના પરિપત્રો અનુસાર EGM નોટિસ નેશનલ ડિપોઝિટરી સર્વિસ લિમિટેડ (NSDL) ની વેબસાઇટ www.evoting.nsdl.cor પર અને કંપનીની વેબસાઇટ www.bhaktijewellery.com પર પણ ઉપલબ્ધ છે.

#### EGM દરમિયાન રિમોટ ઇ-વોટિંગ અને ઇ-વોટિંગઃ

સેબી (LODR) રેગ્યુલેશન્સ, ૨૦૧૫ ના નિયમન ૪૪ અને ICSI દારા જારી કરાયેલ જનરલ મીટિંગ (\*SS-2\*) પરના સેક્રેટરીયલ સ્ટાન્ડર્ડ્સ હેઠળ ત્યાં બનાવેલા નિયમો સાથે વાંચવામાં આવેલ કંપની એક્ટ, ૨૦૧૩ ની કલમ ૧૦૮ મુજબ, કંપની સુવિધ પૂરી પાડી રહી છે. તેના તમામ સભ્યોને એનએસડીએલ દારા પૂરી પાડવામાં ઈલેક્ટ્રોનિક વોટિંગ સિસ્ટમનો ઉપયોગ કરીને ઈલેક્ટ્રોનિક માધ્યમથી (ઈ-વોટિંગ) **ઢારા ઈજીએમની નોટિસમાં નિર્ધારિત તમામ ઠરાવો પર** તેમનો વોટ આપવા. સભ્યોન વોટિંગ અધિકારો મંગળવાર, ૨૩/૦૪/૨૦૨૪ ("કટ-ઓફ તારીખ") ના રોજ કંપનીના પેઇડ-અપ ઇક્વિટી શેરમાં તેમના ઢારા રાખવામાં આવેલા ઇક્વિટી શેરના પ્રમાણમાં હોવા જોઈએ, કંપની અધિનિયમ, ૨૦૧૩ ની જોગવાઈ અનુસાર જરૂરી વિગતો અને તેના હેઠળ બનાવેલા નિયમો નીચે આપેલ છેઃ

(૧) બુક બંધ કરવાનો સમયગાળો બુધવાર, ૨૪/૦૪/૨૦૨૪ થી મંગળવાર, ૩૦/૦૪/૨૦૨૪ મંને દિવસો સહિત) ના રોજ થશે; (૨ઁ) રીમોટ ઈ-વોટિંગ સમયગાળો શનિવાર, ૨૭/૦૪/૨૦૨૪ ના રોજ સવારે ૯.૦૦ વાગ્યે શરૂ ધશે અને સોમવાર, ૨૯/૦૪/૨૦૨૪ ના રોજ સાંજે ૫.૦૦ વાગ્યે સમાપ્ત થશે. (૩) ઈ-વોટિંગના અધિકારો નક્કી કરવા માટેની કટ-ઓફ તારીખ મંગળવાર, ૨૩/૦૪/૨૦૨૪ છે; (૪) સભ્યોને ઉપરોક્ત જણાવેલ સમયગાળ પછી રીમોટ ઈ-વોટિંગ ઢારા વોટિંગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં; (પ શેરધારક કંપનીનો હિસ્સો મેળવે છે અને નોટિસ મોકલ્યા પછી કંપનીના સભ્ય બને દ અને કટ-ઓફ તારીખથી શેર હોલ્ડિંગ કરે છે તેઓ તેમના વોટિંગ અધિકારોનો ઉપયોગ કરવા માટે ઈજીએમની નોટિસમાં જણાવેલ પગલાંને અનુસરી શકે છે; (૬) જે સભ્યોચ ઈજીએમ પહેલાં રિમોટ ઈ-વોટિંગ દ્વારા તેમનો વોટ આપ્યો છે તેઓ પણ ઈજીએમ મ હેજરી/ભાગ લઈ શકશે પરંતુ તેઓ કરીશી તેમનો વોટ આપવા માટે હઠદાર રહેશે નહીં. જે સભ્યોએ રિમોટ ઈ-વોટિંગ હારા પોતાનો વોટ આપ્યો નથી તેઓ ઈજીએમ દરમિયાન ઈ-વોટિંગ સુવિધા દારા વોટ આપવા માટે હકદાર રહેશે. (૭) જે વ્યક્તિ નામ સભ્યોના રજિસ્ટરમાં અથવા ડિપોઝિટરીઝ દ્વારા જાળવવામાં આવેલા લાભાર્થી માલિકોના રજિસ્ટરમાં માત્ર કટ-ઓફ તારીખે નોંધાયેલું છે તે રિમોટ ઈ-વોટિંગન જુનરલ મીટિંગમાં સુવિધા મેળવવા તેમજ વોટિંગમાં માટે હકદાર છે. (૮) રિમોરં ઈ-વોટિંગને લગતી કોંઈપણ પ્રશ્નો/ફરિયાદોના કિસ્સામાં તમે શેરધારકો માટે વારવાર પૂછાતા પ્રશ્નો ('FAQs') અને મુદદ હેઠળ www.evoting.nsdl.com પર ઉપલબ્ધ શેરધારકો માટે ઈ-વોટિંગ વપરાશકર્તા માર્ગદર્શિકા વિભાગમાં જોઈ શકો છો અથવા ૦૨૨ ૨૩૦૫૮૫૪૨/૪૩ ૫૨ સંપર્ક કરો. (૯) બોર્ડે મેસર્સ નીલમ સોમાણી એન્ડ એસોસ્વિએટ્સ, પ્રેક્ટિસિંગ કંપની સેક્રેટરીની નિમણુક કરી છે જે ઈ-વોટિંગ પ્રક્રિયાની ચકાસણી માટે સ્કુટિનાઈઝર તરીકે કામ કરશે.

ભક્તિ જેમ્સ એન્ડ જ્વેલરી લિમિટેડ માટે તારીખ : ૦૩-૦૪-૨૦૨૪ sd/- અક્ષચ સેવંતીલાલ મહેતા મેનેજિંગ ડિરેકટર (DIN: 02986761) સ્થળ : અમદાવાદ

Need the well Qualified Faculty for well known Degree Engineering College. Only Qualified Candidates send their detail resume with necessary marksheet and documents on or before 14-04-2024 by Registered A.D. or speed Post on below address. Qualification as per AICTE, GTU & State Govt. Norms.

Khadiya - Bilkha Road, Po. Toraniya, Ta. / Dist. Junagadh, AT. KHADIYA (362263) Mo.No. 8238945600

### વીરમ સિક્ચોરિટીઝ લિમિટેડ

રજિસ્ટર્ડ ઓફિસ : ઓફિસ નંબર ૩૧૨/એ, સન ગ્રેવિટાસ, મૌજે - વેજલપુર, અમદાવાદ 3COOUS II Website : www.veeramsecuritiesItd.com II Contact No. : 8420969108 Email : compliancingveeram@gmail.com || CIN : L65100GJ2011PLC064964

### સભ્યોને પોસ્ટલ બેલેટની નોટિસ

આથી નોટિસ આપવામાં આવે છે કે કલમ ૧૧૦ અને અન્ય લાગુ જોગવાઈઓ, જો કોઈ હોય તો, કંપની અધિનિયમ, ૨૦૧૩ (કોઈપણ વૈધાનિક ફેરફાર(કોઈપણ કાયદાકીય કેરફાર(ઓ) અથવા તેના અમલમાં રહેલા પુનઃ અધિનિયમ(ઓ) સહિત) નિયમ ૨૦ સાથે વાંચવામાં આવે છે અને કંપનીઝ (મેનેજમેન્ટ એન્ડ એડમિનિસ્ટ્રેશન) નિયમો, ૨૦૧૪ ના નિયમ ૨૨ (કોઈપણ વૈધાનિક ફેરફાર(ઓ) અથવા તેના અમલમાં રહેલા પુનઃઅધિનિયમો સહિત), SEBI LODR રેગ્યુલેશન્સ, ૨૦૧૫ ના નિયમન ૪૪, સામાન્ય પરિંપત્ર નંબર ૧૪/૨૦૨૦ તારીખ ૮ એપ્રિલ, ૨૦૨૦ એને ૧૭/૨૦૨૦ તારીખ ૧૩ એપ્રિલ, ૨૦૨૦ અન્ય સંબંધિત પરિપત્રો સાથે વાંચતા, જેમાં ૨૩ જૂન, ૨૦૨૧ ના સામાન્ય પરિપત્ર નં. ૧૦/૨૦૨૧ અને ૨૦/૨૦૨૧ યારીખ ૦૮ ડિસેમ્બર, ૨૦૨૧ દ્વારા જારી કરવામાં આવેલ એમસીએ પરિષત્રો, ICSI દ્વારા જારી કરાયેલ જનરલ મીટિંગઓ પરના સચિવાલયના ધોરણો અને અન્ય કોઈપણ લાગુ પડતા કાયદા, નિયમો અને વિનિયમો (કોઈપણ વૈધાનિક ફેરફાર(કોઈપણ કાયદાકીય ફેરફાર(ઓ) અથવા તેના અમલમાં રહેલા પુનઃ અધિનિયમ(ઓ) સહિત), ની મંજૂરી મેળવવા માટે સભ્યોએ ૨૯ માર્ચ, ૨૦૨૪ની પોસ્ટલ બેલેટ નોટિસમાં સમાવિષ્ટ વ્યાપારના વ્યવહાર માત્ર રિમોટ ઈ-વોટિંગ પ્રક્રિયા દ્વારા પોસ્ટલ બેલેટ દ્વારા આ ઠરાવો પસાર કરીને કરવો.

એમસીએના પરિપત્રો અનુસાર, આ પોસ્ટલ બેલેટ નોટિસ કક્ત તે સભ્યોને જ ઇલેકટોનિક ોડ દારા મોકલવામાં આવી રહી છે જેમના નામ સભ્યોના રજિસ્ટર/ લાભદાયી માલિકોની સૂચિ પર શુક્રવાર, ૨૯મી માર્ચ, ૨૦૨૪ ("કટ-ઓફ તારીખ") પર દેખાય છે. ડિપોઝિટરીઝ માંથી પ્રાપ્ત થયેલ છે અને જેનું ઈમેલ સરનામું કંપની / ડિપોઝિટરીઝમાં નોંધાયેલ છે. આ પૂરેસ્ટ્લ બે્લેટ માટે પોસ્ટલ બે્લેટ નોટિસની ફીઝીકલ નકલો અને પોસ્ટ્લ બેલેટ ફોર્મ્સ અને પ્રી-પેઇડ બિઝનેસ રિપ્લાય એન્વલપ્સ સભ્યોને મોકલવામાં આવતા નથી.

બોર્ડે મેસર્સ નીલમ સોમાણી એન્ડ એસોસિએટ્સ, પ્રેક્ટિસિંગ કંપની સેક્રેટરીની નિમણુક કરી છે જે ઈ-વોટિંગ પ્રક્રિયાની ચકાસણી કરવા માટે સ્કૂટિનાઈઝર તરીકે કામ કરશે, ેઓ વોટિંગના પરિણામો ચેરમેનને સબમિટ કરશે.

કંપનીએ સભ્યોને રિમોટ ઈ-વોટિંગ સુવિધાઓ પૂરી પાડવા માટે NSDL ની સેવાઓ લીધેલ છે, જેથી તેઓ ઈલેક્ટ્રોનિક અને સુરક્ષિત રીતે તેમનો વોટ આપી શકે.

રિમોટ ઈ-વોટિંગ સુવિધા નીચેના સમયગાળા દરમિયાન ઉપલબ્ધ રહેશે:

ઈ-વોટિંગની શરૂઆત : ગુરૂવાર ૪થી એપ્રિલ, ૨૦૨૪ સવારે ૦૯:૦૦ વાગ્યે. ઈ-વોટિંગનો અંત : શકવાર ૩જી મે, ૨૦૨૪ના રોજ સાંજે ૦૫:૦૦ વાગ્યે.

તભ્યોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ તેમની સંમતિ (માટે) અથવા અસંમતિ (વિરુદ્ધ) સભ્યાન ાવનતા કરવામાં આવે છે કે તેઓ તેમના સમાત (માટ) અથવા અસમાત (ાવરુઢ) રિમોટ ઈ-વોટિંગ પ્રક્રિયા દ્વારા શુક્રવાર 3જી મે, ૨૦૨૪ ના રોજ સાંજના ૫.૦૦ વાગ્યા (IST) સુધી જણાવે. ત્યારબાદ NSDL દ્વારા તરત જ રિમોટ ઈ-વોટિંગને બંધ કરવામાં આવશે અને જણાવેલ તારીખ અને સમય પછી તેને મંજૂરી આપવામાં આવશે નહીં. આ સમયગાળા દરમિયાન, કટ-ઓફ તારીખ એટલે કે શુક્રવાર ૨૯મી માર્ચ ૨૦૨૪ના રોજ, ફીઝીકલ અથવા ઈલેક્ટ્રોનિક સ્વરૂપમાં શેર ધરાવનાર કંપનીના સભ્યો ઈલેક્ટ્રોનિક રીતે તેમનો વોટ આપશે. વોટિંગના અધિકારોની ગણતરી કટ-ઓફ તારીખે સભ્ય (આ)ના નામ પર નોંધાયેલા શેરના ચૂકવેલ મૂલ્ય પર પણ કરવામાં આવશે. એકવાર સભ્ય દ્વારા ઠરાવ પર વોટ આપવામાં આવે પછી સભ્યને તેમાં ફેરફાર કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

દરાવ, જો મંજૂર કરવામાં આવે તો, ઈ-વોટિંગની છેલ્લી તારીખ એટલે કે શુક્રવાર ૩જી મે, ૨૦૨૪ના રોજ પસાર કરવામાં આવ્યો હોવાનું માનવામાં આવશે. વોટિંગના પરિણામો પમી , ૨૦૨૪ના રોજ અથવા તે પહેલાં જાહેર કરવામાં આવશે.

રમોટ ઈ-વોટિંગ માટેની પ્રક્રિયા અને રીત એટેચ કરેલી નોટિસનો ભાગ બનતી નોંધોમાં વિગતવાર છે બા નોટિસ કંપનીની વેબસાઇટ www.veeramsecuritiesltd.com પર પણ ઉપલબ્ધ છેઃ BSE લિમિટેડની વેબસાઇટ www.bseindia.com ના સંબંધિત વિભાગઃ કે જેના પર કંપનીના ઇક્વિટી શેર સૂચિબદ્ધ છે અને NSDLની વેબસાઇટ www.evoting.nsdl.com પર કોઈપણ પ્રશ્નોના કિસ્સામાં, www.evoting.nsdl.com ના ડાઉનલો ડવિભાગ પર ઉપલબ્ધ શેરધારકો માટે વારંવાર પૂછાતા પ્રક્ષો (FÅQs) અને શેરધારકો માટે ઈ-વોટિંગ વપરાશકર્તા માર્ગદર્શિકાનો સંદર્ભ લઈ શકો છો અથવા ૦૨૨ - ૪૮૮૬ ૭૦૦૦ પર કૉલ કરી શકો છો બથવા evoting@nsdl.com પર વિનંતી મોકલી શકો છો.

સ્થળ : અમદાવાદ

વીરમ સિક્યોરિટીઝ લિમિટેડ વતી તારીખ : ૦૩-૦૪-૨૦૨૪ sd/- મહેન્દ્રભાઈ રમણીકલાલ શાહ મેનેજિંગ ડિરેકટર (DIN : 03144827)